

21 જાન્યુઆરી 2019

બ્રેમ્પટને ખાનગી માલિકીના કેનાબિસ રિટેઇલ સ્ટોર્સનાં પક્ષમાં મત આપ્યા

બ્રેમ્પટન, ઓન્ટારિયો – અનેક સપ્તાહનાં સાર્વજનિક પરામર્શના ફલસ્વરૂપ, આજે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે ખાનગી માલિકીના કેનાબિસ રિટેઇલ સ્ટોર્સ બ્રેમ્પટનમાં ખુલે તેનાં પક્ષમાં મત આપ્યો.

દ અલ્કોહોલ એન્ડ ગેમિંગ કમિશન ઓફ ઓન્ટારિયો (AGCO) ખાનગી કેનાબિસ રિટેઇલ સ્ટોર્સનું લાયસન્સિંગ, રિન્યુઅલ અને બજાવણીનું વ્યવસ્થાપન કરશે. બ્રેમ્પટન ખાતે કોઈ પણ સ્ટોર વહેલામાં વહેલો 01 એપ્રિલ 2019 ના રોજ ખુલી શકશે.

કેનાબિસ ઓક્ટોબર 2018માં કાયદેસર થયું હોવાથી કેનાબિસનો ઉપયોગને તે વિસ્તારોમાં મંજૂરી છે જ્યાં ધૂમ્રપાનને મંજૂરી મળી હોય. કેનાબિસના ઉપયોગની બજાવણીમાં સીટી પીલ રિજનલ પોલિસ અન પીલ પબ્લિક હેલ્થ ખાતેના તેમના સહયોગીઓ સાથે કાર્ય કરવાનું ચાલુ રાખશે.

સ્ટોર્સનું લાયસન્સિંગ એટલેકે પરવાના જારી કરવા બાબત

ખાનગી રિટેઇલર્સ એટલેકે છૂટક વિકેતાઓનું નિયમન અને તેઓને પરવાના AGCO દ્વારા જારી થશે. ઓન્ટારિયો પ્રાંતે ડિસેમ્બર 2018માં જાહેર કર્યું હતું કે તેઓ 01 એપ્રિલ 2019 સુધીમાં ઓન્ટારિઓ ફરતે સ્ટોર્સ ખોલવા માટે 25 પરવાના જારી કરશે જેમાં GTA રિજન (ડરહમ, યોર્ક, પીલ, હાલ્ટન)માં મહત્તમ છ રિટેઇલ સ્ટોર્સ ટૂંકા ગાળા માટે હશે. છૂટક વિકેતાઓને તેમના સ્ટોર્સમાં 19ની વય કરતા ઓછી વય ધરાવતા કોઈ પણ વ્યક્તિઓને પ્રવેશ આપવાની પરવાનગી મળશે નહીં.

સ્ટોર્સનું ઠેકાણું

કાયદેસર રિટેઇલ સ્ટોર્સ દ્વારા શાળાઓથી ઓછામાં ઓછું 150 મીટરનું અંતર રાખવાની આવશ્યકતા રહેશે. અંતર મર્યાદાના આધારે એવી મિલકતો જેમને છૂટક ટુકાનો બનાવવાની મંજૂરી મળેલ ક્ષેત્રો બનાવવામાં આવ્યા હોય તે સીટી વેબસાઇટ પર ઉપલબ્ધ આ [નકશા](#) પર હાઈલાઈટ કરવામાં આવ્યા છે.

સ્ટોરના પ્રસ્તાવિત ઠેકાણાના 15 દિવસની જાહેર અધિસૂચનાનાં સમયગાળાને AGCO સુલભ કરશે. AGCO માટે આ એક તક છે કે તેઓ જનતાના પ્રતિભાવો અને સમાજની ચિંતાઓ પ્રાપ્ત કરી શકે. સૂચિત સ્ટોર્સની વિગતો AGCO વેબસાઇટ પર [iAGCO પોર્ટલ](#) મારફત ઉપલબ્ધ કરાશે જ્યાં તેઓને ટિપ્પણીઓ આપવાની સીધી તક હશે જ્યારે લાયસન્સ થયેલ રિટેઇલ જગ્યાઓ ઓળખી કાઢવામાં આવે. જો જાહેર હિતમાં હોય તો AGCO રજિસ્ટ્રાર સ્ટોરને અધિકૃત કરવા નકારી શકે છે. નિયમો દ્વારા વ્યાખ્યાયિત હોય તે મુજબ રજિસ્ટ્રાર ફક્ત એવા જાહેર હિતનાં ક્ષેત્રો ધ્યાન પર લઈ શકે જે જાહેર આરોગ્ય અને સુરક્ષા સાથે સંબંધ ધરાવતા હોય, યુવાધનનું રક્ષણ કરે અને કેનાબિસ સુધી તેઓની પહોંચ પર અંકુશ લગાવે અને જે કેનાબિસ અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી રોકે.

નગરપાલિકા ભંડોળ

14 જાન્યુઆરી 2019ના રોજ સીટી ઓફ બ્રમ્પટન અને રિજન ઓફ પીલને પ્રત્યેકને પ્રાંત એટલેકે પ્રોવિન્સ તરફથી \$2,20,018ની પ્રથમ ચુકવણી ઓન્ટારિયો કેનાબિસ લિગલાઇઝેશન ઈમ્પ્લિમેન્ટેશન ફંડ (OCLIF) મારફત પ્રાપ્ત થઈ. કાઉન્સિલ દ્વારા ભાગ લેવાના નિર્ણય પછી સીટી હવે પ્રાંત તરફથી વધારાનું ભંડોળ મેળવવા માટે હકદાર છે.

કેનાબિસનો ઉપયોગ અમલમાં લાવવો

બ્રમ્પટન ખાતે સ્મોક ફ્રી ઓન્ટારિયો એક્ટ હેઠળ જ્યાં પણ તમાકુનાં સેવનની મંજૂરી હોય ત્યાં રિક્રિએશનલ એટલેકે મનોરંજનલક્ષી કેનાબિસનું ધૂમ્રપાન કરવું કાયદેસર છે. કેનાબિસ ક્યાં કાયદેસર છે તેની વિગતો માટે [વારંવાર પૂછાતા પ્રશ્નો](#) વાંચો. રિક્રિએશનલ કેનાબિસના ઉપયોગનું અમલીકરણ આ મુજબ થશે:

- પીલ રિજનલ પોલિસ ફેડરલ એટલેકે સમવાયી અને પ્રાંતીય કેનાબિસના કાયદાનો અમલ કરવા જવાબદાર છે
- પીલ પબ્લિક હેલ્થ સ્મોક ફ્રી ઓન્ટારિયો એક્ટનો અમલ કરશે અને તમાકુનેમજ કેનાબિસનો ઉપયોગ કરવાના સ્થળો વિષયક વ્યવહાર કરશે
- સીટી ઓફ બ્રમ્પટન કોર્પોરેટ સિક્યોરિટી એન્ડ એન્ફોર્સમેન્ટ એન્ડ બાય-લો સર્વિસિસ સીટીની માલિકીની મિલકતો પર અમલીકરણમાં સામેલ હશે દા.ત. પાર્ક્સ; અને કોઈ ગરબડ થવાની ફરિયાદોના પ્રતિભાવરૂપે વિવિધ પેટા-નિયમો લાગુ કરશે. કેનાબિસના ગેરકાનૂની ઉપયોગ વિશે સર્વિસ બ્રમ્પટન (311)નો સંપર્ક કરો.

ક્વોટ

"સમાજ સાથે અમારી ખૂબ જ ખુલ્લી અને ઊંડાણપૂર્વકની વિચારણા થઈ ચુકી છે અને અમે તેમનો આટલા સક્રિય રીતે સંકળાયેલા રહેવા બદલ આભાર માનીએ છીએ. નિવાસીઓ પાસેથી અમે ધ્યાન પર લીધા તેવા અનેક પ્રશ્નો અને અભિપ્રાયો મારફત કાયદેસર રીતે ચાલતા કેનાબિસનાં સ્ટોરની પહોંચ મેળવવા બદલ અને પ્રાંતીય ભંડોળનું મહત્ત્વ છતું થયું હતું. શાળાઓ ઉપરાંત અન્ય સંવેદનશીલ જમીન આસપાસનાં સાઈટ ઠેકાણાના અને બહુરનાં ઉપયોગ સંબંધિત પ્રતિબંધો લાદવાની ક્ષમતા માટે સીટી, નગરપાલિકાને લાંબા ગાળાના ભંડોળ અંગેના મોડેલ માટે હિમાયત કરવા સતત સરકારના ઉચ્ચ સ્તર સાથે સક્રિય રીતે જોડાણ ચાલુ રાખશે"

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्युडान्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca